

B.Com. Semester - 6 (CBCS) Examination**March/April -2020****INDIRECT TAX LAW -2 (DSE-3)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 (A)	એક્સાઇઝેબલ માલ વિષે વિગતવાર સમજાવો.	(10)
(B)	સેન્ટ્રલ એક્સાઇઝ કાયદાનો અર્થ અને ખ્યાલ સમજાવો.	(10)
	અથવા	
પ્રશ્ન-1	સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકનનાં નિયમો વિગતે વર્ણવો.	(20)
પ્રશ્ન-2 (A)	સેન્ટ્રલ એક્સાઇઝની સામાન્ય પ્રક્રિયા સમજાવો.	(10)
(B)	સેન્ટ્રલ એક્સાઇઝ અને જોબવર્ક.	(10)
	અથવા	
પ્રશ્ન-2	એક્સાઇઝના કાયદા મુજબ “નાના પાયાના ઉદ્યોગોને મળતી રાહત” વિષે વિગતે સમજાવો.	(20)
પ્રશ્ન-3	કસ્ટમનાં કાયદાનો અર્થ અને ખ્યાલ સમજાવો.	(15)
	અથવા	
પ્રશ્ન-3	કસ્ટમ ડ્યુટીનો અર્થ અને ખ્યાલ સમજાવો.	(15)
પ્રશ્ન-4	કસ્ટમ ડ્યુટીના વિવિધ પ્રકારો વિગતવાર સમજાવો.	(15)
	અથવા	
પ્રશ્ન-4 (A)	કસ્ટમ ડ્યુટીની વસુલાત માટે આયાત માલનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે.	(08)
(B)	કસ્ટમ ડ્યુટીની વસુલાત માટે નિકાસ માલનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે.	(07)

ENGLISH VERSION

Que-1 (A)	Explain in detail on Excisable Goods.	(10)
(B)	Explain the meaning and concept of central Excise Law.	(10)
	OR	
Que-1	Explain in detail of Central Excise valuation rules.	
Que-2 (A)	Explain the General procedure of Central Excise.	(10)
(B)	Central Excise and Job Work.	(10)
	OR	
Que-2	Explain in detail “Concession to Small Scale Industry” under central Excise Act.	(20)
Que-3	Explain the meaning and concept of Customs Law.	(15)
	OR	
Que-3	Explain the meaning and concept of Customs Duties.	(15)
Que-4	Explain in detail of various types of Custom Duties.	(15)
	OR	
Que-4 (A)	For determination of Custom duty, How the valuation of Imported Goods?	(08)
(B)	For determination of Custom duty, How the valuation of Exported Goods?	(07)
